

B.Com. Semester - 6 (CBCS) Examination**May/June-2021 (OLD COURSE)****AUDITING AND CORPORATE GOVERNANCE -2(DSE-1)****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ મિલકતોની ચકાસણી અને મૂલ્યાંકનનો અર્થ આપો? તે અંગે ઓડીટરની ફરજો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૨ વહેંચણીપાત્ર નફો એટલે શું? તે અંગે ઓડીટરની ફરજો જણાવો. અને તેને અસર કરતા પરિબલો ચર્ચો. (૧૪)
- પ્રશ્ન.૩ ઓડીટ રીપોર્ટ અને ઓડીટ પ્રમાણપત્રનો અર્થ આપો? તેમજ ઓડીટરની જવાબદારીને ધ્યાનમાં લઈ સારા ઓડીટ અહેવાલના લક્ષણો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૪ કોર્પોરેટ ગવર્નન્સના સંદર્ભમાં નૈતિક આચારસંહિતાની કમિટી અને ગ્રીન ગવર્નન્સ કે પર્યાવરણ સુસંચાલનનો ખ્યાલ સમજાવો (૧૪)
- પ્રશ્ન.૫ ટૂંક નોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- [A] મિલકતોની ચકાસણી સમજાવો
- [B] વચગાળાનું ડીવીડન્ડ સમજાવો
- [C] ‘સાચો’ અને ‘વ્યાજબી’ ઓડીટ અહેવાલનો ખ્યાલ સમજાવો
- [D] કોર્પોરેટ ગવર્નન્સ રીપોર્ટ

ENGLISH VERSION

- Q.1 Give the meaning of Valuation and Verification of assets? State the duties of an auditor towards verification and valuation of assets. (14)
- Q.2 What is Divisible profit? State the duties of an auditor and the factor affecting to divisible profit (14)
- Q.3 Give the meaning of Audit Report and Audit Certificate? State the characteristics of a good audit report by seeing the auditor's responsibilities (14)
- Q.4 Explain the concepts of Ethics Committee and Green Governance in context to corporate governance (14)
- Q.5 Write short note : (Any TWO) (14)
- [A] Explain verification of assets
- [B] Explain Interim Dividend
- [C] Explain the concept of ‘True’ and ‘Fair’ Audit report
- [D] Corporate governance report
